

Stocks and Securities

Aditya Birla Money Ltd.

(A subsidiary of Aditya Birla Capital Ltd.)



**ADITYA BIRLA
CAPITAL**

PROTECTING INVESTING FINANCING ADVISING

Ref: SECTL/2021 – 100

October 14, 2021

BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
MUMBAI – 400 001

National Stock Exchange of India Limited
Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G-Block,
Bandra-Kurla Complex, Bandra (East)
MUMBAI – 400 051

Scrip Code: BSE – 532974

NSE – BIRLA MONEY

Dear Sir / Madam,

Sub : Intimation under Regulations 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to Regulations 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached the newspaper advertisements regarding the Unaudited financial results of the Company for the quarter and half year ended 30th September 2021 published in Business Standard and Jai Hind.

The same shall be uploaded on the Company's website www.adityabirlamoney.com.

This is for your information and record.

Thanking you,

Yours faithfully,

For **Aditya Birla Money Limited**

Sangeeta Shetty
Company Secretary

Aditya Birla Money Ltd.

Sai Sagar, 2nd & 3rd Floor, Plot No.: M-7, Thiru-Vi-Ka (SIDCO) Industrial Estate,
Guindy, Chennai - 600 032 | +91 44 4949 0000 / 4949 0200
care.stocksandsecurities@adityabirlacapital.com
www.stocksandsecurities.adityabirlacapital.com

Registered Office:

Indian Rayon Compound, Veraval
Gujarat - 362 266
CIN: L65993GJ1995PLC064810

Business Standard
MUMBAI EDITION

Printed and Published by Sangita Kheora on behalf of Business Standard Private Limited and Printed at M/s. Dangat Media Private Limited, 22 Digha M.I.D.C., TTC Industrial Area, Vishnu Nagar, Digha, Navi Mumbai, 400708 and M/s. Dainik Bhaskar, Plot no. 10, 11, Sector B, Industrial Area, Govindpura, Bhopal (M.P.) 462023. & Published at H/4 & U/3, Building H, Paragon Centre, Opp. Birla Centrium, B.B. Marg, Worli, Mumbai-400013

Editor : Shailesh Dobhal

RNI NO: 66308/1996

Readers should write their feedback at feedback@bsmail.in
Fax: +91-11-23720201

For Subscription and Circulation enquiries please contact:
Ms. Mansi Singh
Head-Customer Relations
Business Standard Private Limited,
H/4 & U/3, Building H, Paragon Centre, Opp. Birla Centrium, B.B. Marg, Worli, Mumbai - 400013
E-mail: subs_bs@bsmail.in
or sms, REACHBS TO 57575

Overseas subscription:
(Mumbai Edition Only)

One year subscription rate by air mail
INR 51765 : USD 725

DISCLAIMER News reports and feature articles in Business Standard seek to present an unbiased picture of developments in the markets, the corporate world and the government. Actual developments can turn out to be different owing to circumstances beyond Business Standard's control and knowledge. Business Standard does not take any responsibility for investment or business decisions taken by readers on the basis of reports and articles published in the newspaper. Readers are expected to form their own judgement. Business Standard does not associate itself with or stand by the contents of any of the advertisements accepted in good faith and published by it. Any claim related to the advertisements should be directed to the advertisers concerned. Unless explicitly stated otherwise, all rights reserved by M/s Business Standard Pvt. Ltd. Any printing, publication, reproduction, transmission or redissertation of the contents, in any form or by any means, is prohibited without the prior written consent of M/s Business Standard Pvt. Ltd. Any such prohibited and unauthorised act by any person/legal entity shall invite civil and criminal liabilities.

No Air Surcharge

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL, CHENNAI BENCH
COMPANY PETITION NO. CP/63/CAA/2021 CONNECTED WITH
COMPANY SCHEME APPLICATION NO. CA/1210/CAA/2019
In the matter of Scheme of Arrangement of G M S Processors Private Limited and its Shareholders and Creditors

G M S Processors Private Limited, a Company incorporated under the provisions of Companies Act, 1956 and having its registered office at SF. 134/1C, Kiran Garden, Arulapuram, Tirupur – 641 605, Tamil Nadu, India
... **Petitioner Company**
AND
Their Respective Shareholders

Notice of Hearing of Petition
(Under Rule 16 of Companies (Arrangements & Amalgamations) Rules, 2016)

NOTICE is hereby given that the Company Petition under Section 230-232, for sanctioning the Scheme of Arrangement of GMS Processors Private Limited and their respective shareholders and Creditors ("Scheme"), was presented by the Petitioner Company and was admitted by the Hon'ble National Company Law Tribunal ("NCLT"), Chennai Bench on the 04th March 2021. The Hon'ble Tribunal vide Order dated 01st September 2021, fixed **27th October, 2021 as the date of hearing** for sanction of the Company Petition CP/63/CHE/2021. The copy of the said Petition has also been served upon the statutory authorities.

Any person desirous of opposing the said Company Petition should send their representation to the Petitioner Company's Authorised Representative at the address mentioned below, by way of a notice, signed by him/her or his/her advocates, with his/her address, so as to reach the Applicant Company's Authorised Representative and the NCLT, Chennai Bench at Corporate Bhawan (UTI Building), III Floor, No.29, Rajaji Salai, Chennai, Tamil Nadu 600001, not later than two days before the date fixed for hearing of the Company Petition along with the grounds of opposition or a copy of his/her affidavit along with such notice.

A Copy of the Company Petition will be furnished by the Petitioner Company's Authorised Representative to any person requiring the same on the payment of prescribed charges and towards expenses thereof.

Sd/-
Dr.C.V.Madhusudhanan,
Partner, KSR & CO Company Secretaries LLP
Authorised Representative of Petitioner Company
Address: KSR & Co Company Secretaries LLP,
"Indus Chambers" Ground Floor, No. 101,
Govt. Arts College Road, Coimbatore – 641 018.

Date : 13.10.2021

Stocks and Securities

Aditya Birla Money Ltd.



PROTECTING INVESTING FINANCING ADVISING

Regd. Office: Indian Rayon Compound, Veraval - 362 266, Gujarat; CIN: L65993G1995PLC064810; Email: abml.investorgrievance@adityabirlacapital.com; Website: www.adityabirlamoney.com; Tel.: +91-44-49490000; Fax.: +91-44-22501095.



Statement of Unaudited Financial Results for the Quarter and Half Year Ended September 30, 2021
(Rupees in Lakhs) Except per share data

Sr No.	Particulars	Quarter Ended			Half Year Ended		Year Ended
		September 30, 2021	June 30, 2021	September 30, 2020	September 30, 2021	September 30, 2020	March 31, 2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations	5,719.15	5,281.83	4,896.20	11,000.98	9,280.38	19,060.80
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	909.03	790.02	613.41	1,699.05	1,115.26	2,239.96
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	909.03	790.02	613.41	1,699.05	1,115.26	2,239.96
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	642.97	562.12	434.93	1,205.09	789.35	1,578.38
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	643.77	564.96	433.25	1,208.73	829.15	1,660.93
6	Paid-up Equity Share Capital (Face Value of Re.1/- each)	563.75	563.01	563.01	563.75	563.01	563.01
7	Reserves (excluding Revaluation Reserve)						4,225.27
8	Securities Premium Account	495.25	456.56	456.56	495.25	456.56	456.56
9	Net Worth	6,022.34	5,353.24	3,956.51	6,022.34	3,956.51	4,788.28
10	Outstanding Debt	47,915.70	45,301.79	31,122.84	47,915.70	31,122.84	37,670.38
11	Outstanding Redeemable Preference Shares (Nos. in lakhs)	10.00	10.00	10.00	10.00	10.00	10.00
12	Debt Equity Ratio (No. of Times)	7.96	8.46	7.87	7.96	7.87	7.87
13	Debt Service Coverage Ratio (No. of Times)	0.13	0.13	0.18	0.13	0.17	0.14
14	Interest Service Coverage Ratio (No. of Times)	2.93	2.76	2.43	2.85	2.28	2.33
15	Earnings Per Equity Share (Of Re.1/- each)						
	(a) Basic	1.14	1.00	0.77	2.14	1.40	2.80
	(b) Diluted	1.14	1.00	0.77	2.14	1.40	2.80
		(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Annualised)

Notes:

- The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its Meeting held on October 13, 2021. The Unaudited Financial Results of the Company for the Quarter and Half Year ended September 30, 2021 have been subjected to Limited Review by the Auditors.
- The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulations 33 and 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. For the items referred in relevant sub-clauses of Regulation 52(4) of the SEBI Listing Regulations, the pertinent disclosures have been made to the Stock Exchanges viz. National Stock Exchange of India Limited and BSE Limited and the full format of the Unaudited Financial Results is available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.adityabirlamoney.com.

Place: Mumbai
Date: October 13, 2021

By Order of the Board
For Aditya Birla Money Limited
Tushar Shah
Director
DIN: 00239762



R SYSTEMS INTERNATIONAL LIMITED

Corporate Identification Number (CIN): L74899DL1993PLC053579
Registered Office: GF-1-A, 6, Devika Tower, Nehru Place, New Delhi, India- 110019
Correspondence Address: C- 40, Sector - 59, Noida, District Gautam Budh Nagar, Uttar Pradesh, India-201307
Tel. No.: +91 120-4303500 | E-mail: rsil@rsystems.com | Website: www.rsystems.com
Contact Person: Mr. Bhasker Dubey, Company Secretary and Compliance Officer
Tel. No.: +91-120 4303566 | E-mail: investors@rsystems.com

POST BUYBACK PUBLIC ANNOUNCEMENT FOR THE ATTENTION OF THE EQUITY SHAREHOLDERS/ BENEFICIAL OWNERS OF THE EQUITY SHARES OF R SYSTEMS INTERNATIONAL LIMITED

This post Buyback public announcement (the "Post Buyback Public Announcement") is being made in compliance with Regulation 24(vi) of the Securities and Exchange Board of India (Buy-Back of Securities) Regulations, 2018 and subsequent amendments thereof (the "Buyback Regulations"). This Post Buyback Public Announcement should be read in conjunction with the Public Announcement dated August 06, 2021 published on August 10 2021 (the "Public Announcement") and the Letter of Offer dated September 06, 2021 (the "Letter of Offer"). The terms used but not defined in this Post Buyback Public Announcement shall have the same meanings as assigned in the Public Announcement and the Letter of Offer.

1. THE BUYBACK

1.1. R Systems International Limited (the "Company") had announced Buyback up to 1,333,000 (Thirteen Lakhs Thirty Three Thousand Equity Shares) fully paid-up equity shares of face value ₹ 1/- each ("Equity Shares") ("Buyback"), from all the fully paid-up equity shareholders/ beneficial owners of the Equity Shares of the Company as on the record date i.e. Friday, August 27, 2021 ("Record Date"), on a proportionate basis, through the "Tender Offer" route, at a price of ₹ 225/- (Rupees Two Hundred And Twenty Five Only) per Equity Share (the "Buyback Price") for an aggregate amount of up to ₹ 299,925,000/- (Rupees Twenty Nine Crore Ninety Nine Lakhs Twenty Five Thousand Only) (the "Buyback Size"). The Buyback is in accordance with Article 70 of the Articles of Association of the Company and subject to the provisions of Section 68, 69, 70 and other applicable provisions of the Companies Act, 2013 (the "Companies Act"), the Companies (Share Capital and Debentures) Rules, 2014, the Companies (Management and Administration) Rules, 2014, as applicable and in compliance with Securities and Exchange Board of India (Buy-Back of Securities) Regulations, 2018 (the "Buyback Regulations") including any amendments, statutory modifications or re-enactments thereof, for the time being in force, and is subject to other approvals, permissions, sanctions and exemptions as may be required from time to time from any statutory and/ or regulatory authorities including but not limited to Securities and Exchange Board of India, National Stock Exchange of India Limited, BSE Limited, Registrar of Companies, Reserve Bank of India, etc. The Buyback Size is 8.73% and 7.64% of the aggregate paid-up equity share capital and free reserves (including securities premium account) as per the standalone and consolidated audited balance sheet of the Company as on December 31, 2020, respectively (the last standalone and consolidated audited balance sheet available for the financial year as on the date of the Board meeting approving the proposal of the Buyback, held on August 06, 2021) and is within the statutory limits of 10% of the total paid-up equity share capital and free reserves (including securities premium account) as per the last standalone and consolidated audited financial statements of the Company for financial year ended December 31, 2020. The Equity Shares bought back represent 1.11% of the total number of paid-up equity share capital of the Company.

1.2. The Buyback Size does not include any expenses incurred or to be incurred for the Buyback like filing fees payable to the Securities and Exchange Board of India ("SEBI"), brokerage, applicable taxes (such as Income Tax, Buyback Taxes, Securities Transaction Tax, Stamp Duty and Goods and Services Tax), advisors' fees, public announcement publication expenses, printing and dispatch expenses and other incidental and related expenses ("Transaction Cost").

1.3. The Company adopted the tender offer route for the purpose of the Buyback. The Buyback was implemented using the "Mechanism for acquisition of shares through Stock Exchange" notified by the Securities and Exchange Board of India ("SEBI") vide circular CIR/CFD/POLICYCELL/1/2015 dated April 13, 2015 read with SEBI circular CFD/ DCR2/CIR/P/2016/131 dated December 9, 2016, including any amendments thereof, issued by SEBI. For the purposes of the Buyback, BSE Limited was the designated stock exchange.

1.4. The Buyback Offer was kept open from Monday, September 20, 2021 till Friday, October 01, 2021.

2. DETAILS OF THE BUYBACK

- 1,333,000 Equity Shares were bought back under the Buyback, at a price of ₹ 225/- (Rupees Two Hundred Twenty Five Only) per Equity Share.
- The total amount utilised in the Buyback is ₹ 299,925,000/- (Rupees Twenty Nine Crores Ninety Nine Lakhs Twenty Five Thousand only) excluding transaction costs.
- The Registrar to the Buyback, i.e., Link Intime India Private Limited, considered a total of 2,071 valid applications for 48,066,105 Equity Shares in response to the Buyback offer resulting in the subscription of approximately 36.06 times. The details of the applications considered by the Registrar are as under:

Particulars	Number of Equity Shares available for Buyback	Total no. of bids received in the category	Total Equity Shares bid in the category	Total valid Bids received in the category**	Total valid Equity Shares received in the category**	No. of times (total valid Equity Shares received in the category to the total no. of Equity Shares proposed to be bought back
Reserved Category	199,950	1,958	228,647	1,958	227,200	1.14
General Category	1,133,050	113	47,838,905	113	47,838,905	42.22
Not in Master file*	-	22	3,806	-	-	-
Total	1,333,000	2,093	48,071,358	2,071	48,066,105	36.06

*22 bids for 3,806 Equity Shares were not considered since they were not shareholders as on Record Date.

**Excludes excess bid by 15 shareholders for 1,447 Equity Shares under Reserved Category over and above their shareholding as on Record Date hence such equity shares have not been considered for acceptance.

2.4. All valid bids were considered for the purpose of acceptance in accordance with the Buyback Regulations and the Letter of Offer. The communication of acceptance / rejection was dispatched by the Registrar, via email, to the relevant Eligible Shareholders (who have their e-mail IDs registered with the Company) on October 12, 2021. In cases where email IDs were not registered with the Company or depositories, physical letters of acceptance/rejection were dispatched to the Eligible Shareholders by the Registrar and the same was completed on October 12, 2021.

2.5. The settlement of all valid bids was completed by the Clearing Corporation Limited on October 12, 2021. The funds in respect of accepted Equity Shares were paid out to the respective Seller Members/ custodians.

2.6. Demat Equity Shares accepted under the Buyback were transferred to the Company's demat account on October 12, 2021. The unaccepted demat Equity Shares were returned to respective Seller Members/ custodians by the Clearing Corporation Limited on October 12, 2021. There were no Physical Shares tendered in the Buyback.

2.7. The extinguishment of 1,333,000 Equity Shares (all in dematerialized form) accepted under the Buy Back is currently under process and shall be completed by October 19, 2021.

2.8. The Company, and its respective directors, accept full responsibility for the information contained in this Post Buyback Public Announcement and also accept responsibility for the obligations of the Company laid down under the Buyback Regulations.

2.9. Details of shareholders from whom Equity Shares exceeding 1% of the total Equity Shares bought back have been accepted under the Buyback Offer are as under:

Sr. No.	Name of Shareholder	Number of Equity Shares accepted under the Buyback	Equity Shares accepted as a % of total Equity Shares bought back	Equity Shares accepted as a % of total Post Buyback Equity Shares
1	Bhavook Tripathi	501,079	37.59	0.42
2	Sartaj Singh Rekhi	184,021	13.81	0.16
3	Ramneet Singh Rekhi	160,174	12.02	0.14
4	The Satinder & Harpreet Rekhi Family Trust	115,438	8.66	0.10
5	Satinder Singh Rekhi	72,996	5.48	0.06
6	Harpreet Rekhi	50,476	3.79	0.04
7	Brahm Precision Materials Pvt. Ltd.	26,323	1.97	0.02

CAPITAL STRUCTURE AND SHAREHOLDING PATTERN

2.9. The capital structure of the Company, pre and post Buy-Back, is as under:

(Rupees in million)

Particulars	Pre-Buyback	Post Buy Back*
Authorised Share Capital		
206,000,000 equity shares of ₹ 1 each	206.00	206.00
Issued, Subscribed and Paid Up Share Capital (Pre Buyback)		
119,636,445 equity shares of ₹ 1 each fully paid-up ⁽¹⁾	119.64 ⁽¹⁾	-
Issued, Subscribed and Paid Up Share Capital (Post Buyback)		
118,303,445 equity shares of ₹ 1 each fully paid-up	-	118.30
Total Paid-up Capital	119.64⁽¹⁾	118.30

⁽¹⁾ As on Record Date i.e. August 27, 2021.

*The Company shall extinguish all the shares bought back during the Buy-Back offer i.e. 1,333,000 Equity Shares.

2.11. The shareholding pattern of the Company, pre and post Buy-Back, is as under:

Category of shareholder	Pre Buyback ⁽¹⁾		Post Buyback ⁽²⁾	
	Number of Shares	% to the existing Equity Share Capital	Number of Shares	% to the existing Equity Share Capital
Promoters and Promoter Group	61,713,074	51.58	61,129,969	51.67
Foreign Investors (including Non Resident Indians/ FIs/ Foreign Mutual Funds/ Foreign Nationals)	45,193,996	37.78	57,173,476	48.33
Financial Institutions/ Banks and Mutual Funds promoted by Banks/ Institutions/ NBFCs	1,950	0.00		
Others (Public, Bodies Corporate, etc.)	12,727,425	10.64		
Total	119,636,445	100.00	118,303,445	100.00

⁽¹⁾ As on Record Date i.e. August 27, 2021.

⁽²⁾ On the basis of buyback of 1,333,000 Equity Shares. Extinguishment of the same is under process.

3. MANAGER TO THE BUYBACK



Motilal Oswal Investment Advisors Limited
Motilal Oswal Tower, Rahimtullah Sayani Road
Opposite Parel ST Depot, Prabhadevi, Mumbai- 400 025
Maharashtra, India
Tel: +91 22 7193 4380
E-mail: rsil.buyback2021@motilaloswal.com
Investor Grievance E-mail: moaipredressal@motilaloswal.com
Website: www.motilaloswalgroup.com
Contact person: Ms. Ritu Sharma
SEBI Registration No.: INM000011005
CIN: U67190MH2006PLC160583

4. DIRECTORS RESPONSIBILITY

As per Regulation 24(i)(a) of the Buyback Regulations, the Directors of the Company accepts full and final responsibility for the information contained in this Post Buyback Public Announcement and confirms that it contains true, factual and material information and does not contain any misleading information.

For and on behalf of the Board of Directors of R Systems International Limited

Sd/-
Name: Dr. Satinder Singh Rekhi
Managing Director & Chief Executive Officer
DIN:00006955

Sd/-
Name: Lt. Gen. Baldev Singh (Retd.)
President & Senior Executive Director
DIN:00006966

Sd/-
Name: Bhasker Dubey
Company Secretary & Compliance Officer
Membership No.: A33287

Place: Singapore
Date: October 13, 2021

Place: Noida (U.P.), India
Date: October 13, 2021

Place: Noida (U.P.), India
Date: October 13, 2021

